

ફિલિપિન: પત્ર

I પૌલતીમથિનામાનૌ યીશુખ્રીષ્ટસ્ય દાસૌ ફિલિપિનગરસ્થાન્ પ્રીષ્ટયીશોઃ સર્વાન્ પવિત્રલોકાન્ સમિતેરધ્યક્ષાન્ પરિચારકાંશ્ચ પ્રતિ પત્રં લિખતઃ।

II અસ્માકં તાત ઈશ્વરઃ પ્રભુ રીશુખ્રીષ્ટશ્ચ યુષ્મભ્યં પ્રસાદસ્ય શાન્તેશ્ચ ભોગં દેયાસ્તાં।

III અહં નિરન્તરં નિજસર્વપ્રાર્થનાસુ યુષ્માકં સર્વેષાં કૃતે સાનન્દં પ્રાર્થનાં કુર્વન્

IV યતિ વારાન્ યુષ્માકં સ્મરામિ તતિ વારાન્ આ પ્રથમાદ્ અથ યાવદ્

V યુષ્માકં સુસંવાદભાગિત્વકારણાદ્ ઈશ્વરં ધન્યં વદામિ।

VI યુષ્મન્મધ્યે યેનોત્તમં કર્મ કર્તુમ્ આરમ્ભિ તેનૈવ યીશુખ્રીષ્ટસ્ય દિનં યાવત્ તત્ સાધયિષ્યત ઇત્યસ્મિન્ દૃઢવિશ્વાસો મમાસ્તે।

VII યુષ્માન્ સર્વાન્ અધિ મમ તાદૃશો ભાવો યથાર્થો યતોડહં કારાવસ્થાયાં પ્રત્યુત્તરકરણે સુસંવાદસ્ય પ્રામાણ્યકરણે ચ યુષ્માન્ સર્વાન્ મયા સાર્દ્ધમ્ એકાનુગ્રહસ્ય ભાગિનો મત્વા સ્વહૃદયે ધારયામિ।

VIII અપરમ્ અહં પ્રીષ્ટયીશોઃ સ્નેહવત્ સ્નેહેન યુષ્માન્ કીદૃશં કાઙ્ક્ષામિ તદધીશ્વરો મમ સાક્ષી વિદ્યતે।

IX મયા યત્ પ્રાર્થ્યતે તદ્ ઇદં યુષ્માકં પ્રેમ નિત્યં વૃદ્ધિં ગત્વા

X જ્ઞાનસ્ય વિશિષ્ટાનાં પરીક્ષિકાયાશ્ચ સર્વવિધબુદ્ધેર્બાહુલ્યં ફલતુ,

XI પ્રીષ્ટસ્ય દિનં યાવદ્ યુષ્માકં સારલ્યં નિર્વિદ્નત્વઞ્ચ ભવતુ, ઈશ્વરસ્ય ગૌરવાય પ્રશંસાયૈ ચ યીશુના પ્રીષ્ટેન પુણ્યફલાનાં પૂર્ણતા યુષ્મભ્યં દીયતામ્ ઇતિ।

XII હે ભ્રાતરઃ, માં પ્રતિ યદ્ યદ્ ઘટિતં તેન સુસંવાદપ્રચારસ્ય બાધા નહિ કિન્તુ વૃદ્ધિરેવ જાતા તદ્ યુષ્માન્ જ્ઞાપયિતું કામયેડહં।

XIII અપરમ્ અહં પ્રીષ્ટસ્ય કૃતે બદ્ધોડસ્મીતિ રાજપુર્યામ્ અન્યસ્થાનેષુ ચ સર્વેષાં નિકટે સુસ્પષ્ટમ્ અભવત્,

XIV प्रभुसम्बन्धीया अनेके भ्रातरश्च मम बन्धनाद् आश्वासं प्राप्य
वर्द्धमानेनोत्साहेन निःक्षोभं कथां प्रचारयन्ति।

XV केसिद् द्वेषाद् विरोधाख्यापरे केसिय्य सद्भावात् प्रीष्टं घोषयन्ति;

XVI ये विरोधात् प्रीष्टं घोषयन्ति ते पवित्रभावात् तन्न कुर्वन्तो मम
बन्धनानि बहुतरकलोशदायीनि कर्तुम् ष्यन्ति।

XVII ये य प्रेम्ना घोषयन्ति ते सुसंवाद्यस्य प्रामाण्यकरणेऽहं
नियुक्तोऽस्मीति ज्ञात्वा तत् कुर्वन्ति।

XVIII किं बहुना? कापट्यात् सरलभावाद् वा भवेत्, येन
केनयित् प्रकारेण प्रीष्टस्य घोषणा भवतीत्यस्मिन् अहम्
आनन्दाभ्यान्दिष्यामि य।

XIX युष्माकं प्रार्थनया यीशुप्रीष्टस्यात्मनश्चोपकारेण तत्
मन्निस्तारणकं भविष्यतीति ज्ञानामि।

XX तत्र य ममाङ्गुक्षा प्रत्याशा य सिद्धिं गमिष्यति कुलतोऽहं केनापि
प्रकारेण न लज्जिष्ये किन्तु गते सर्वस्मिन् काले यद्दत्तं तद्दत्तं एतानीमपि
सम्पूर्णात्साहद्वारा मम शरीरेण प्रीष्टस्य महिमा ज्ञवने मरणे वा
प्रकाशिष्यते।

XXI यतो मम ज्ञवने प्रीष्टाय मरणञ्च लाभाय।

XXII किन्तु यदि शरीरे मया ज्ञवितव्यं तर्हि तत् कर्मफलं इतिष्यति
तस्मात् किं वरितव्यं तन्मया न ज्ञायते।

XXIII द्वाभ्याम् अहं सम्पीड्ये, देहवासत्यजनाय प्रीष्टेन सहवासाय
य ममाभिलाषो भवति यतस्तत् सर्वोत्तमं।

XXIV किन्तु देहे ममावस्थित्या युष्माकम् अधिकप्रयोजनं।

XXV अहम् अवस्थास्ये युष्माभिः सर्वैः सार्द्धम् अवस्थितिं करिष्ये
य तथा य विश्वासे युष्माकं वृद्धानन्दौ जनिष्येते तदहं निश्चितं
ज्ञानामि।

XXVI तेन य मतोऽर्थतो युष्मत्समीपे मम पुनरुपस्थितत्वात् यूयं
प्रीष्टेन यीशुना बहुतरम् आह्लादं लप्स्यध्वे।

XXVII यूयं सावधाना भूत्वा प्रीष्टस्य सुसंवाद्यस्योपयुक्तम् आचारं
कुरुध्वं यतोऽहं युष्मान् उपागत्य साक्षात् कुर्वन् किं वा दूरे तिष्ठन्

યુષ્માકં યાં વાર્તાં શ્રોતુમ્ ઇચ્છામિ સેયં યૂયમ્ એકાત્માનસ્તિષ્ઠથ, એકમનસા સુસંવાદસમ્બન્ધીયવિશ્વાસસ્ય પક્ષે યતધ્વે, વિપક્ષૈશ્ચ કેનાપિ પ્રકારેણ ન વ્યાકુલીક્રિયધ્વ ઇતિ।

XXVIII તત્ તેષાં વિનાશસ્ય લક્ષણં યુષ્માકન્નેશ્વરદત્તં પરિત્રાણસ્ય લક્ષણં ભવિષ્યતિ।

XXIX યતો યેન યુષ્માભિઃ પ્રીષ્ટે કેવલવિશ્વાસઃ ક્રિયતે તન્નહિ કિન્તુ તસ્ય કૃતે ક્લેશોડપિ સહ્યતે તાદૃશો વરઃ પ્રીષ્ટસ્યાનુરોધાદ્ યુષ્માભિઃ પ્રાપિ,

XXX તસ્માત્ મમ યાદૃશં યુદ્ધં યુષ્માભિરદર્શિ સામ્પ્રતં શ્રૂયતે ચ તાદૃશં યુદ્ધં યુષ્માકમ્ અપિ ભવતિ।

II

I પ્રીષ્ટાદ્ યદિ કિમપિ સાન્ત્વનં કશ્ચિત્ પ્રેમજાતો હર્ષઃ કિચ્ચિદ્ આત્મનઃ સમભાગિત્વં કાચિદ્ અનુકમ્પા કૃપા વા જાયતે તર્હિ યૂયં મમાહ્વાદં પૂરયન્ત

II એકભાવા એકપ્રેમાણ એકમનસ એકચેષ્ટાશ્ચ ભવતા

III વિરોધાદ્ દર્પાદ્ વા કિમપિ મા કુરુત કિન્તુ નમ્રતયા સ્વેભ્યોડપરાન્ વિશિષ્ટાન્ મન્યધ્વાં

IV કેવલમ્ આત્મહિતાય ન ચેષ્ટમાનાઃ પરહિતાયાપિ ચેષ્ટધ્વાં

V પ્રીષ્ટસ્ય યીશો યાદૃશઃ સ્વભાવો યુષ્માકમ્ અપિ તાદૃશો ભવતુ।

VI સ ઈશ્વરરૂપી સન્ સ્વકીયામ્ ઈશ્વરતુલ્યતાં શ્લાઘાસ્પદં નામન્યત,

VII કિન્તુ સ્વં શૂન્યં કૃત્વા દાસરૂપી બભૂવ નરાકૃતિં લેભે ચા

VIII ઇત્યં નરમૂર્તિમ્ આશ્રિત્ય નમ્રતાં સ્વીકૃત્ય મૃત્યોરર્થતઃ કુશીયમૃત્યોરેવ ભોગાયાજ્ઞાગ્રાહી બભૂવા

IX તત્કારણાદ્ ઈશ્વરોડપિ તં સર્વોન્નતં ચકાર યચ્ચ નામ સર્વેષાં નામ્નાં શ્રેષ્ઠં તદેવ તસ્મૈ દદૌ,

X તતસ્તસ્મૈ યીશુનામ્ને સ્વર્ગમર્ત્યપાતાલસ્થિતૈઃ સર્વે જાનુપાતઃ કર્તવ્યઃ,

XI તાતસ્થેશ્વરસ્ય મહિમ્ને ચ યીશુપ્રીષ્ટઃ પ્રભુરિતિ જિહ્વાભિઃ સ્વીકર્તવ્યાં

XII અતો હે પ્રિયતમાઃ, યુષ્માભિ ર્થદ્ધત્ સર્વ્વદા ક્રિયતે તદ્ધત્ કેવલે મમોપસ્થિતિકાલે તન્નહિ કિન્ત્વિદાનીમ્ અનુપસ્થિતેડપિ મયિ બહુતરયત્નેનાજાં ગૃહીત્વા ભયકમ્પાભ્યાં સ્વસ્વપરિત્રાણં સાધ્યતાં

XIII યત ઈશ્વર એવ સ્વકીયાનુરોધાદ્ યુષ્મન્મધ્યે મનસ્કામનાં કર્મસિદ્ધિઞ્ચ વિદધાતિ

XIV યૂયં કલહવિવાદવિજતમ્ આચારં કુર્વન્તોડનિન્દનીયા અકુટિલા

XV ઈશ્વરસ્ય નિષ્કલઙ્કાશ્ચ સન્તાનાઇવ વકભાવાનાં કુટિલાચારિણાઞ્ચ લોકાનાં મધ્યે તિષ્ઠત,

XVI યતસ્તેષાં મધ્યે યૂયં જીવનવાક્યં ધારયન્તો જગતો દીપકા ઇવ દીપ્યધ્વો યુષ્માભિસ્તથા કૃતે મમ યત્નઃ પરિશ્રમો વા ન નિષ્ફલો જાત ઇત્યહં પ્રીષ્ટસ્ય દિને શ્લાઘાં કર્તુ શક્ષ્યામિ

XVII યુષ્માકં વિશ્વાસાર્થકાય બલિદાનાય સેવનાય ચ યદાપ્યહં નિવેદિતવ્યો ભવેયં તથાપિ તેનાનન્દામિ સર્વ્વેષાં યુષ્માકમ્ આનન્દસ્યાંશી ભવામિ ચા

XVIII તદ્દદ્ યૂયમધ્યાનન્દત મદીયાનન્દસ્યાંશિનો ભવત ચા

XIX યુષ્માકમ્ અવસ્થામ્ અવગત્યાહમપિ યત્ સાન્ત્વનાં પ્રાપ્નુયાં તદર્થં તીમથિયં ત્વરયા યુષ્મત્સમીપં પ્રેષયિષ્યામીતિ પ્રભૌ પ્રત્યાશાં કુર્વ્વો

XX યઃ સત્યરૂપેણ યુષ્માકં હિતં ચિન્તયતિ તાદૃશ એકભાવસ્તસ્માદન્યઃ કોડપિ મમ સન્નિઘૌ નાસ્તિ

XXI યતોડપરે સર્વ્વે યીશોઃ પ્રીષ્ટસ્ય વિષયાન્ ન ચિન્તયન્ત આત્મવિષયાન્ ચિન્તયન્તિ

XXII કિન્તુ તસ્ય પરીક્ષિતત્વં યુષ્માભિ જ્ઞાયતે યતઃ પુત્રો યાદૃક્ પિતુઃ સહકારી ભવતિ તથૈવ સુસંવાદસ્ય પરિચર્યાયાં સ મમ સહકારી જાતઃ

XXIII અતએવ મમ ભાવિદશાં જ્ઞાત્વા તત્ક્ષણાત્ તમેવ પ્રેષયિતું પ્રત્યાશાં કુર્વ્વો

XXIV સ્વયમ્ અહમપિ તૂર્ણ યુષ્મત્સમીપં ગમિષ્યામીત્યાશાં પ્રભુના કુર્વ્વો

XXV અપરં ચ ઇપાફ્રદીતો મમ ભ્રાતા કર્મયુદ્ધાભ્યાં મમ સહાયશ્ચ યુષ્માકં દૂતો મદીયોપકારાય પ્રતિનિધિશ્ચાસ્તિ યુષ્મત્સમીપે તસ્ય પ્રેષણમ્ આવશ્યકમ્ અમન્યે।

XXVI યતઃ સ યુષ્માન્ સર્વાન્ અકાઙ્ક્ષત યુષ્માભિસ્તસ્ય રોગસ્ય વાર્તાશ્રાવીતિ બુદ્ધ્વા પર્યશોચચ્ચ।

XXVII સ પીડયા મૃતકલ્પોડભવદિતિ સત્યં કિન્ત્વીશ્વરસ્તં દયિતવાન્ મમ ચ દુઃખાત્ પરં પુનર્દુઃખં યન્ન ભવેત્ તદર્થં કેવલં તં ન દયિત્વા મામપિ દયિતવાન્।

XXVIII અતએવ યૂયં તં વિલોક્ય યત્ પુનરાનન્દેત મમાપિ દુઃખસ્ય હાસો યદ્ ભવેત્ તદર્થમ્ અહં ત્વરયા તમ્ અપ્રેષયં।

XXIX અતો યૂયં પ્રભોઃ કૃતે સમ્પૂર્ણોનાનન્દેન તં ગૃહ્ણીત તાદૃશાન્ લોકાંશ્ચાદરણીયાન્ મન્યધ્વાં।

XXX યતો મમ સેવને યુષ્માકં ત્રુટિં પૂરયિતું સ પ્રાણાન્ પણીકૃત્ય ખ્રીષ્ટસ્ય કાર્યાર્થં મૃતપ્રાયેડભવત્।

III

I હે ભ્રાતરઃ, શેષે વદામિ યૂયં પ્રભાવાનન્દતા પુનઃ પુનરેકસ્ય વયો લેખનં મમ કલેશદં નહિ યુષ્મદર્થંચ ભ્રમનાશકં ભવતિ।

II યૂયં કુક્કુરેભ્યઃ સાવધાના ભવત દુષ્કર્મકારિભ્યઃ સાવધાના ભવત છિન્નમૂલેભ્યો લોકેભ્યશ્ચ સાવધાના ભવત।

III વયમેવ છિન્નત્વયો લોકા યતો વયમ્ આત્મનેશ્વરં સેવામહે ખ્રીષ્ટેન યીશુના શ્લાઘામહે શરીરેણ ચ પ્રગલ્ભતાં ન કુર્વામહે।

IV કિન્તુ શરીરે મમ પ્રગલ્ભતાયાઃ કારણં વિદ્યતે, કશ્ચિદ્ યદિ શરીરેણ પ્રગલ્ભતાં ચિકીર્ષતિ તર્હિ તસ્માદ્ અપિ મમ પ્રગલ્ભતાયા ગુરુતરં કારણં વિદ્યતે।

V યતોડહમ્ અષ્ટમદિવસે ત્વક્ષેદ્રપ્રાપ્ત ઇસ્રાયેલ્વંશીયો બિન્યામીનગોષ્ઠીય ઇબ્રિકુલજાત ઇબ્રિયો વ્યવસ્થાયરણે ફિરૂશી

VI ધર્મોત્સાહકારણાત્ સમિતેરુપદ્રવકારી વ્યવસ્થાતો લભ્યે પુણ્યે યાનિન્દનીયઃ।

VII કિન્તુ મમ યદત્ લભ્યમ્ આસીત્ તત્ સર્વ્વમ્ અહં પ્રીષ્ટસ્યાનુરોધાત્ ક્ષતિમ્ અમન્યે

VIII કિન્તુ આધુનાપ્યહં મત્ત્રભોઃ પ્રીષ્ટસ્ય યીશો જ્ઞાનસ્યોત્કૃષ્ટતાં બુદ્ધ્વા તત્ સર્વ્વ ક્ષતિમ્ અન્યે

IX યતો હેતોરહં યત્ પ્રીષ્ટં લભ્યે વ્યવસ્થાતો જાતં સ્વકીયપુણ્યઞ્ચ ન ધારયન્ કિન્તુ પ્રીષ્ટે વિશ્વસનાત્ લભ્યં યત્ પુણ્યમ્ ઈશ્વરેણ વિશ્વાસં દૃષ્ટ્વા દીયતે તદેવ ધારયન્ યત્ પ્રીષ્ટે વિદ્યેય તદર્થ તસ્યાનુરોધાત્ સર્વ્વેષાં ક્ષતિં સ્વીકૃત્ય તાનિ સર્વ્વાણ્યવકરાનિવ અન્યે

X યતો હેતોરહં પ્રીષ્ટં તસ્ય પુનરુત્થિતે ગુણં તસ્ય દુઃખાનાં ભાગિત્વઞ્ચ જ્ઞાત્વા તસ્ય મૃત્યોરાકૃતિઞ્ચ ગૃહીત્વા

XI યેન કેનચિત્ પ્રકારેણ મૃતાનાં પુનરુત્થિતિં પ્રાપ્તું યતો

XII મયા તત્ સર્વ્વમ્ અધુના પ્રાપિ સિદ્ધતા વાલમ્બિ તન્નહિ કિન્તુ યદર્થમ્ અહં પ્રીષ્ટેન ધારિતસ્તદ્ ધારયિતું ધાવામિ

XIII હે ભ્રાતરઃ, મયા તદ્ ધારિતમ્ ઇતિ ન અન્યતે કિન્ત્વેતદ્દૈકમાત્રં વદામિ યાનિ પશ્ચાત્ સ્થિતાનિ તાનિ વિસ્મૃત્યાહમ્ અગ્રસ્થિતાન્યુદિશ્ય

XIV પૂર્ણચત્નેન લક્ષ્યં પ્રતિ ધાવન્ પ્રીષ્ટયીશુનોદ્ધ્વાત્ મામ્ આહ્વયત ઈશ્વરાત્ જેતૃપણં પ્રાપ્તું ચેષ્ટે

XV અસ્માકં મધ્યે યે સિદ્ધાસ્તૈઃ સર્વ્વેસ્તદેવ ભાવ્યતાં, યદિ ચ કઞ્ચન વિષયમ્ અધિ યુષ્માકમ્ અપરો ભાવો ભવતિ તર્હીશ્વરસ્તમપિ યુષ્માકં પ્રતિ પ્રકાશયિષ્યતિ

XVI કિન્તુ વયં યદદ્ અવગતા આસ્મસ્તત્રાસ્માભિરેકો વિધિરાચરિતવ્ય એકભાવૈ ભવિતવ્યઞ્ચ

XVII હે ભ્રાતરઃ, યૂયં મમાનુગામિનો ભવત વચઞ્ચ યાદૃગાચરણસ્ય નિદર્શનસ્વરૂપા ભવામસ્તાદૃગાચારિણો લોકાન્ આલોકયધ્વા

XVIII યતોડનેકે વિપથે ચરન્તિ તે ચ પ્રીષ્ટસ્ય કુશસ્ય શત્રવ ઇતિ પુરા મયા પુનઃ પુનઃ કથિતમ્ અધુનાપિ રુદતા મયા કથ્યતો

XIX તેષાં શેષદશા સર્વ્વનાશ ઉદરશ્ચેશ્વરો લજ્જા ચ શ્લાઘા પૃથિવ્યાઞ્ચ લગ્નં મનઃ

XX કિન્ત્વસ્માકં જનપદઃ સ્વર્ગે વિદ્યતે તસ્માચ્યાગમિષ્યન્તં ત્રાતારં પ્રભું યીશુપ્રીષ્ટં વયં પ્રતીક્ષામહા

XXI स य यया शक्त्या सर्वाण्येव स्वस्य वशीकर्तुं पारयति तयास्माकम् अधमं शरीरं उपान्तरीकृत्य स्वकीयतेजोमयशरीरस्य समाकारं करिष्यति।

IV

I हे मदीयानन्दमुकुटस्वर्पाः प्रियतमा अभीष्टतमा भ्रातरः, हे मम स्नेहपात्राः, यूयम् एतत् पत्रौ स्थिरास्तिष्ठत।

II हे एवदिये हे सुन्तुषि युवां प्रभौ अेकभावे भवतम् अेतद् अहं प्रार्थये।

III हे मम सत्य सङ्कारिन् त्वामपि विनीय वदामि अेतयोरुपकारस्त्वया क्रियतां यतस्ते क्लीमिनादिभिः सङ्कारिभिः साद्धं सुसंवाद्यप्रयारणाय मम साहाय्यार्थं परिश्रमम् अकुर्वतां तेषां सर्वेषां नामानि य ञ्चवनपुस्तके लिपितानि विद्यन्ते।

IV यूयं प्रभौ सर्व्वदानन्दता पुन र्वदामि यूयम् आनन्दता।

V युष्माकं विनीतत्वं सर्व्वमानवै ज्ञायितां, प्रभुः सन्निधौ विद्यते।

VI यूयं किमपि न यिन्तयत किन्तु धन्यवाद्युक्ताभ्यां प्रार्थनायाञ्चाभ्यां सर्व्वविषये स्वप्रार्थनीयम् ईश्वराय निवेदयत।

VII तथा कृत ईश्वरीया या शान्तिः सर्वा बुद्धिम् अतिशेते सा युष्माकं यित्तानि मनांसि य प्रीष्टे यीशौ रक्षिष्यति।

VIII हे भ्रातरः, शेषे वदामि यद्यत् सत्यम् आदरणीयं न्याय्यं साधु प्रियं सुख्यातम् अन्येण येन केनचित् प्रकारेण वा गुणयुक्तं प्रशंसनीयं वा भवति तत्रैव मनांसि निधध्वं।

IX यूयं मां दृष्ट्वा श्रुत्वा य यद्यत् शिक्षितवन्तो गृहीतवन्तश्च तदेवायत् तस्मात् शान्तिदायक ईश्वरो युष्माभिः साद्धं स्थास्यति।

X ममोपकाराय युष्माकं या यिन्ता पूर्व्वम् आसीत् किन्तु कर्मद्वारं न प्राप्नोत् एदानीं सा पुनरङ्गलत् एत्यस्मिन् प्रभौ मम परमाह्लादोऽञ्जायत।

XI अहं यद् दैन्यकारणाद् एहं वदामि तन्नहि यतो मम या कायिद् अवस्था भवेत् तस्यां सन्तोषुम् अशिक्षयं।

XII દરિદ્રતાં ભોક્તું શક્નોમિ ધનાઢ્યતામ્ અપિ ભોક્તું શક્નોમિ સર્વ્વથા સર્વ્વવિષયેષુ વિનીતોડહં પ્રચુરતાં ક્ષુધાઞ્ચ ધનં દૈન્યઞ્ચાવગતોડસ્મિ।

XIII મમ શક્તિદાયકેન ખ્રીષ્ટેન સર્વ્વમેવ મયા શક્યં ભવતિ।

XIV કિન્તુ યુષ્માભિ દૈન્યનિવારણાય મામ્ ઉપકૃત્ય સત્કર્માકારિ।

XV હે ફિલિપીયલોકાઃ, સુસંવાદસ્યોદયકાલે યદાહં માકિદનિયાદેશાત્ પ્રતિષ્ઠે તદા કેવલાન્ યુષ્માન્ વિનાપરયા ક્યાપિ સમિત્યા સહ દાનાદાનયો મમ કોડપિ સમ્બન્ધો નાસીદ્ ઇતિ યૂયમપિ જાનીથા।

XVI યતો યુષ્માભિ મમ પ્રયોજનાય થિષલનીકીનગરમપિ માં પ્રતિ પુનઃ પુનર્દાનં પ્રેષિતાં।

XVII અહં યદ્ દાનં મૃગયે તન્નહિ કિન્તુ યુષ્માકં લાભવદ્ધકં ફલં મૃગયો।

XVIII કિન્તુ મમ કસ્યાપ્યભાવો નાસ્તિ સર્વ્વ પ્રચુરમ્ આસ્તે યત ઈશ્વરસ્ય ગ્રાહ્યં તુષ્ટિજનકં સુગન્ધિનૈવેદ્યસ્વરૂપં યુષ્માકં દાનં ઇપાકૃદિતાદ્ ગૃહીત્વાહં પરિતૃપ્તોડસ્મિ।

XIX મમેશ્વરોડપિ ખ્રીષ્ટેન યીશુના સ્વકીયવિભવનિધિતઃ પ્રયોજનીયં સર્વ્વવિષયં પૂર્ણરૂપં યુષ્મભ્યં દેયાત્।

XX અસ્માકં પિતુરીશ્વરસ્ય ધન્યવાદોડનન્તકાલં યાવદ્ ભવતુ આમેન્।

XXI યૂયં યીશુખ્રીષ્ટસ્યૈકૈકં પવિત્રજનં નમસ્કુરતા મમ સક્ષિભ્રાતરો યુષ્માન્ નમસ્કુર્વ્વતે।

XXII સર્વ્વ પવિત્રલોકા વિશેષતઃ કૈસરસ્ય પરિજના યુષ્માન્ નમસ્કુર્વ્વતે।

XXIII અસ્માકં પ્રભો યીશુખ્રીષ્ટસ્ય પ્રસાદઃ સર્વાન્ યુષ્માન્ પ્રતિ ભૂયાત્ આમેન્।

**Sanskrit Bible (NT) in Gujarati Script
New Testament in Sanskrit Language; printed in
Gujarati Script**

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit SanskritBible.in to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

PDF generated using Haiola and XeLaTeX on 22 Feb 2024 from source files dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01